

2024-2025 COVID-19 રસી સાથે વધારાની સુરક્ષા મેળવો!

પુખ્ત વયના લોકો માટે 65+ અને ઇમ્યુનોકોમ્પ્રોમાઇઝ્ડ (નબળી રોગપ્રતિકારક શક્તિ)

જે લોકોને COVID-19 થી ખૂબ જ બીમાર થવાનું જોખમ વધારે છે અને તેઓ રસીથી વધારાના રક્ષણનો લાભ લઈ શકે છે, તેમાં સામેલ છે:

- 65 વર્ષ અને તેથી વધુ ઉંમરના પુખ્ત વયના લોકો.
- છ મહિના અને તેથી વધુ ઉંમરના વ્યક્તિઓ કે જેમની રોગપ્રતિકારક શક્તિ સાધારણ અથવા ગંભીર રીતે નબળી પડી છે (ઇમ્યુનોકોમ્પ્રોમાઇઝ્ડ).



65+ વર્ષની વય

- છ મહિનાના અંતરે (અથવા ડોઝ વચ્ચે ઓછામાં ઓછા બે મહિના) **બે ડોઝ** મેળવો.
- જો તમને રસી આપવામાં આવી નથી અને તમે તમારી પ્રારંભિક શ્રેણી તરીકે 2024-2025 નોવાવેક્સ COVID-19 રસી લો છો,** તો નોવાવેક્સના **બે ડોઝ** લેવાની ભલામણ કરવામાં આવે છે અને ત્યારબાદ છ મહિના પછી કોઈપણ COVID-19 રસીનો **ત્રીજો ડોઝ** લેવાની ભલામણ કરવામાં આવે છે.

CDC ભલામણો:*



ઇમ્યુનોકોમ્પ્રોમાઇઝ્ડ
(6 મહિના અને તેથી વધુ)

- છ મહિનાના અંતરે (અથવા ડોઝ વચ્ચે ઓછામાં ઓછા બે મહિના) **બે ડોઝ** મેળવો.
- જો તમને રસી આપવામાં આવી નથી, તો 2024-2025 COVID-19 રસી સાથે પ્રારંભિક શ્રેણી પૂર્ણ કરો અને ત્યારબાદ 2024-2025 COVID-19 રસીનો **એક ડોઝ** છ મહિના પછી લો.
- તમારા આરોગ્ય સંભાળ પ્રદાતા સાથે વાત કર્યા પછી તમને 2024-2025 રસીના વધારાના ડોઝ મળી શકે છે.

તમારા આરોગ્ય સંભાળ પ્રદાતા સાથે વાત કરો અને
cdc.gov/covid/vaccines/stay-up-to-date.html ની મુલાકાત લો.



રસી શોધો અને રસી મેળવો!

vaccines.gov ની મુલાકાત લો

વધુ માહિતી માટે, nj.gov/health/vaccines/covid-19 ની
મુલાકાત લો અથવા QR કોડ સ્કેન કરો.



*ભલામણ કરેલી રસી, ડોઝ અને સમય તમારી ઉંમર, અગાઉના રસીકરણના ઇતિહાસ અને અંતર્ગત તબીબી પરિસ્થિતિઓ (દા.ત.; ડાયાબિટીસ, વધારે વજન, હાઈ બ્લડ પ્રેશર વગેરે)ના આધારે અલગ હોઈ શકે છે. તમારા માટે શ્રેષ્ઠ શું હશે તે જોવા માટે તમારા આરોગ્ય સંભાળ પ્રદાતા સાથે વાત કરો. વધુ માહિતી માટે, cdc.gov/covid/index.html ની મુલાકાત લો.

** પ્રારંભિક શ્રેણી એ કોવિડ-19 થી ખૂબ બીમાર થવાથી બચાવવા માટે જરૂરી શરૂઆત અથવા પ્રાથમિક રસીનો ડોઝ છે.